

# Official Spokesperson's response to media queries on the recently released WHO-convened global study on the origin of Covid-19

April 01, 2021

## કોવિડ-19ના મૂળ અંગે હુ દ્વારા યોજાયેલા વૈશ્વિક અભ્યાસ અંગે મીડિયાના સવાલો પર સત્તાવાર પ્રવક્તાનો જવાબ

એપ્રિલ 01, 2021

કોવિડ-19ના ઉદભવ અંગે હુ (વિશ્વ આરોગ્ય સંસ્થા) દ્વારા યોજવામાં આવેલો વૈશ્વિક અભ્યાસ જાહેર થયો છે તે વિશે મીડિયાના પ્રશ્નોના જવાબમાં સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું :

"અમે કોવિડ-19ના ઉદભવ અંગે તાજેતરમાં રિલિઝ થયેલો હુ દ્વારા આયોજિત વૈશ્વિક અભ્યાસ જોયો છે.

2. આ અહેવાલ કોવિડ-19 મહામારીના ઉદભવને સ્થાપિત કરવામાં પ્રથમ પગલાં તરીકે મહત્વનો છે. તેણે આ બીમારી ક્યાંથી પેદા થઈ તે અંગે ચાર માર્ગ દર્શાવ્યા છે, પરંતુ તેણે સમગ્ર વિસ્તારમાં બીજા તબક્કાના અભ્યાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ અહેવાલમાં એ બાબત પર ભાર મૂકાયો છે કે નક્કર તારણ સુધી પહોંચવા માટે વધારે ડેટા અને અભ્યાસની જરૂર છે.

3. અહીં એ બાબતની નોંધ કરવી જરૂરી છે કે ડિરેક્ટર જનરલ ઓફ હુએ આ અભ્યાસ કરનાર ટીમ પાસેથી કાચી માહિતી મેળવવામાં વિલંબ અને મુશ્કેલીઓનો મુદ્દો અલગથી ઉઠાવ્યો હતો. અમે ડિરેક્ટર જનરલની અપેક્ષાને સંપૂર્ણ ટેકો આપીએ છીએ કે ભવિષ્યમાં થનારા સામુહિક અભ્યાસમાં વધારે સમયસર અને વિસ્તૃત ડેટા શેરિંગનો સમાવેશ કરવામાં આવશે. આ અંગે અમે વધારાના મિશન લાગુ કરવા માટેની તેમની તૈયારીને પણ આવકારીએ છીએ.

4. અમે હુના અહેવાલને ફોલો અપ કરવા અથવા વધારે અભ્યાસ કરવા માટે તેમની અપેક્ષાઓને અવાજ આપવામાં બીજા હિતધારકો સાથે જોડાઈએ છીએ, જેમાં હુ દ્વારા સૌથી શરૂઆતમાં જોવા મળેલા માનવ કેસ તથા ક્લસ્ટરની સમજણને તમામ હિતધારકો દ્વારા સૌથી વધુ સહકાર આપવામાં આવશે.

5. અમે એક સંપૂર્ણ અને નિષ્ણાતની આગેવાની હેઠળના મિકેનિઝમની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ જે તમામ હિતધારકો સાથે સહકારમાં કોવિડ-19ના મૂળની તપાસ કરશે. અમે શક્તિ વધારવા અને વૈશ્વિક આરોગ્ય સુરક્ષા સુધારવા માટે હુ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું જેથી વર્તમાન અહેવાલ અને વધારે અભ્યાસ પ્રોટોકોલ વિકસાવવા જરૂરી ઈનપુટ પૂરા પાડશે અને તેનાથી નોલેજ બેઝ વિકસશે તથા જિનોમિક સર્વેલન્સ કુશળતાનો વિકાસ થશે જેનાથી વાઈરસના મ્યુટેશન પર નજર રાખી શકાય અને આગામી વૈશ્વિક રોગચાળાનો સક્રિય રીતે પ્રતિસાદ આપી શકાય."

નવી દિલ્હી

એપ્રિલ 01, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.

